

# કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

( Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૨૮/૨૦૧૫

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. ૧૦/૭/૨૦૧૬

વાદી:-

રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા,  
૫ મનીષાનંદ સોસાયટી,  
શાંતિ વિધાલય પાછળ, લીંક રોડ,  
ભરૂચ જિ. ભરૂચ

વિરુદ્ધ

પ્રતિવાદી:-

(૧) પોલીસ અધિક્ષકશ્રી,  
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,  
કાળી તલાવડી, ભરૂચ  
જિ. ભરૂચ

(૨) પોલીસ મહાનિરીક્ષકશ્રી,  
પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી,  
વડોદરા વિભાગ,  
જિ. વડોદરા

૧. શ્રી રાજેન્દ્રસિંહ જિતેન્દ્રસિંહ વાઘેલા ભરૂચે તા. ૨૩/૧૧/૨૦૧૫ ની અરજીથી રજૂઆત કરેલ છે કે તેઓના પિતાશ્રી જિતેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જુનિયર કલાર્ક તરીકે ફરજો બજાવે છે, તેઓને વિકલાંગ ધારા-૧૯૯૫ અન્વયે જરૂરી રક્ષણ મળેલ ન હોય તે મળવું જોઈએ. ઉપરોક્ત રજૂઆત પરત્વે આ કોર્ટના તા.૧૨/૧/૨૦૧૬ના હુકમથી કરવામાં આવેલ છે.

૨. ઉપરોક્ત હુકમથી શ્રી જિતેન્દ્રસિંહ વાઘેલાની મેડીકલ લીવ મંજૂર કરવા ઉપરાંત પગાર ધોરણ મેળવવાની, બઢતી મેળવવાની તથા પેન્શનના લાભ આપવા અંગે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચને સુચના આપવામાં આવેલ.

૩. ઉપરોક્ત હુકમ પરત્વે ફેર વિચારણા કરવા માટે શ્રી રાજેન્દ્રસિંહ જિતેન્દ્રસિંહ વાઘેલા ધ્વારા તા.૧૮/૧/૨૦૧૬ ના રોજ રજૂઆત કરવામાં આવેલ. પ્રસ્તુત રજૂઆતને આ કોર્ટ ધ્વારા ગ્રાહ્ય રાખી તા.૨૨/૦૨/૨૦૧૬ ના રોજ મુદત રાખવામાં આવેલ.
૪. ઉપરોક્ત મુદતે અરજદારના પુત્ર રાજેન્દ્રસિંહ અને પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ તરફથી કાયદા અધિકારી હાજર રહેલ અને રજૂઆત કરેલ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ ધ્વારા તેમના વિકલાંગ પિતાશ્રીવતી રજૂઆત કરેલ કે તબીબી પ્રમાણપત્ર મુજબ તેમના પિતા ૯૩ ટકા અશક્તતા ધરાવે છે તેઓને તા.૨૬/૮/૨૦૧૫ થી પગાર ભથ્થા અને બઢતી મળેલ નથી. જે આપવા અંગે હુકમ કરવામાં આવે. અરજદાર ધ્વારા વિકલાંગ ધારો-૧૯૯૫ ની કલમ ૪૭ અન્વયે વખતો-વખત જુદા જુદા કેસોમાં મળેલ રક્ષણના પુર્વદષ્ટાંત પણ રજુ કરી તે મુજબના રક્ષણો આપવા રજૂઆત કરેલ.
૫. પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચ કાયદા અધિકારીશ્રી ધ્વારા તા.૪/૭/૨૦૧૬ના પત્ર સાથે રજૂઆત કરવામાં આવેલ કે શ્રી રાજેન્દ્ર સિંહ વાઘેલાના દવાના ખર્ચ રૂ. ૩,૩૮,૫૨૦/- ના બીલો મંજૂર કરવા અંગેની દરખાસ્ત પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગાંધીનગરને કરવામાં આવેલ છે. જે અંગે કોઈ નિર્ણય થઈ આવેલ નથી. શ્રી વાઘેલાને બઢતી આપેલ નથી, તેઓને રહેમરાહે પેન્શન મંજૂર કરવામાં આવેલ નથી. શ્રી વાઘેલાને સેવાકાળ દરમ્યાન વિકલાંગતા આવતા શ્રી વાઘેલાને રક્ષણ આપવા પોલીસ મહાનિરીક્ષક વડોદરાને કરેલ દરખાસ્તનો અસ્વીકાર થયેલ નથી. પ્રસ્તુત કિસ્સામાં વિકલાંગ ધારો-૧૯૯૫ લાગુ પાડી શકાય તેમ જણાવેલ છે.
૬. ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લેતા પ્રસ્તુત કિસ્સામાં નીચે મુજબ જણાય છે.
- શ્રી જિતેન્દ્રસિંહ ગણપતસિંહ ગોહિલની તા.૨/૬/૨૦૧૪ના રોજ અચાનક તબિયત ખરાબ થઈ જતાં તેઓને પેરાલીસીસ અને હેમરેઝ થયેલ છે.
  - તેઓએ તા.૨/૬/૨૦૧૪ થી આજ દિન સુધી માંદગીની રજા પર રહેલ છે.
  - જિતેન્દ્રસિંહ રહેમરાહે નોકરીમાં જોડાયેલ હતાં શ્રી વાઘેલાને અચાનક પેરાલીસીસનો હુમલો થતાં ફરજ પર હાજર થઈ શકેલ નથી.
  - શ્રી વાઘેલા નોકરીના સેવા કાળ દરમ્યાન વિકલાંગતા આવેલ હોય તેમના કિસ્સામાં વિકલાંગ ધારાની કલમ -૪૭ લાગુ પડે છે. પ્રસ્તુત કલમ મુજબ કોઈ પણ કર્મચારીને

પોતાના સેવાકાળ દરમ્યાન વિકલાંગતાના કારણે નીચે પાયરી નીચે ઉતારી શકાશે નહીં કે નોકરીમાંથી દૂર કરી શકાશે નહીં. વિકલાંગતા આવ્યા પછી કર્મચારીને અન્ય જગ્યા પર બદલી કરી શકાશે તથા જે તે જગ્યા પર કર્મચારીને ગોઠવી શકાય તેમ હોય તો તે સંવર્ગમાં અધિક સંખ્યકની જગ્યા પર જ્યાં સુધી તેને યોગ્ય જગ્યા ઉપલબ્ધ નહીં અથવા નિવૃત્તિ ઉંમરે પહોંચે તે બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી અધિક સંખ્યકની જગ્યા પર રાખી શકાશે. તદઉપરાંત વિકલાંગ ધારો-૧૯૯૫ની કલમ-૪૭ (૨) મુજબ કોઈ પણ વિકલાંગ વ્યક્તિને વિકલાંગતાને કારણે બઢતી ઇન્કાર કરી શકાશે નહીં.

આમ ઉપરોક્ત બાબતો જોતાં પ્રસ્તુત કિસ્સામાં જણાય છે કે, શ્રી જિતેન્દ્રસિંહ ગોહિલ સેવા દરમ્યાન વિકલાંગ બનેલ છે અને તેમને વિકલાંગ ધારા, ૧૯૯૫ અન્વયે તેઓને કોઈ રક્ષણ અપાયેલ જણાતુ નથી. જે ધ્યાને લઈ પુનઃ વિચારણા અને નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

### હુકમ

શ્રી જિતેન્દ્રસિંહ ગણપતસિંહ ગોહિલને વિકલાંગતા આવ્યા તા.૨/૬/૨૦૧૪ થી સેવામાં હાજર ગણી તેઓને મળવાપાત્ર રજા પગાર, દવા ખર્ચ વગેરે ચુકવી આપવા તથા શ્રી ગોહિલ માટે કચેરીમાં સંખ્યાધિક જગ્યા ઉભી કરી તે જગ્યા પર તેઓને નિમણુંક આપવા કાર્યવાહી કરવામાં આવે.

ઉપરોક્ત હુકમ સાથે પ્રસ્તુત કેસનો નિકાલ કરવામાં આવે છે.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

- (૧) શ્રી રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા, ૫ મનીષાનંદ સોસાયટી, શાંતિ વિધાલય પાછળ, લીંક રોડ, ભરૂચ જિ. ભરૂચ તરફ જાણ સારૂ.
- (૨) પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, કાળી તલાવડી, ભરૂચ
- (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, વડોદરા વિભાગ, જિ. વડોદરા

